

# ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

## અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટે તા. ૨૬/૦૧/૨૦૧૭ ના રોજ જાહેરાત ક્રમાંક: ૯૯/૨૦૧૬૧૭ થી ૧૧૦/૨૦૧૬૧૭ પ્રસિધ્ધ કરી ઓન-લાઇન અરજીપત્રકો મેળવવામાં આવેલ છે. જે પૈકીની નીચે દર્શાવેલ સંવર્ગોની પ્રથમ તબક્કાની MCQ-OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી ગાંધીનગર ખાતે યોજાનાર છે. જે અન્વયે સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેની તારીખ નક્કી કરીને તા. ૨૭/૦૭/૨૦૧૭ ના રોજ મંડળની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. જે સંદર્ભે ઉક્ત દરેક સંવર્ગની પરીક્ષા માટેના કોલ-લેટર ડાઉનલોડ કરવા માટેનો કાર્યક્રમ નીચે દર્શાવ્યા પ્રમાણેનો મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી.

અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.

### સ્પર્ધાત્મક લેખિત કસોટી

અ. નં.	જાહેરાત ક્રમાંક/ સંવર્ગનું નામ	પરીક્ષાની તારીખ/ સમય	કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ-સમયની વિગતો
૧	૧૦૬/૨૦૧૬૧૭ ખેતી મદદનીશ	૦૯/૦૯/૨૦૧૭ ૧૫-૦૦ થી ૧૭-૦૦	તા. ૩૦/૦૮/૨૦૧૭, અપોરે ૧૪-૦૦ કલાક થી તા. ૦૯/૦૯/૨૦૧૭, અપોરે ૧૫-૦૦ કલાક સુધી
૨	૧૧૦/૨૦૧૬૧૭ આસીસ્ટન્ટ સ્ટોર કીપર	૧૦/૦૯/૨૦૧૭ ૧૨-૦૦ થી ૧૪-૦૦	તા. ૩૦/૦૮/૨૦૧૭, અપોરે ૧૪-૦૦ કલાક થી તા. ૧૦/૦૯/૨૦૧૭, અપોરે ૧૨-૦૦ કલાક સુધી
૩	૧૦૦/૨૦૧૬૧૭ અધિક મદદનીશ ઈજનેર	૧૭/૦૯/૨૦૧૭ ૧૨-૦૦ થી ૧૩-૩૦	તા. ૦૫/૦૯/૨૦૧૭, અપોરે ૧૪-૦૦ કલાક થી તા. ૧૭/૦૯/૨૦૧૭, અપોરે ૧૨-૦૦ કલાક સુધી
૪	૧૦૯/૨૦૧૬૧૭ ફિમેલ હેલ્થ વર્કર	૨૪/૦૯/૨૦૧૭ ૧૨-૦૦ થી ૧૩-૩૦	તા. ૧૨/૦૯/૨૦૧૭, અપોરે ૧૪-૦૦ કલાક થી તા. ૨૪/૦૯/૨૦૧૭, અપોરે ૧૨-૦૦ કલાક સુધી

ઉમેદવારોએ જે તે સંવર્ગની પ્રથમ તબક્કાની MCQ-OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેના કોલ-લેટર તથા તે સાથેની જરૂરી સુચનાઓ સહિત ઉપર દર્શાવેલ નિયત તારીખ-સમયગાળા દરમિયાન "[https:// ojas.gujarat.gov.in](https://ojas.gujarat.gov.in)" વેબસાઇટ પરથી અચૂક (ON LINE) ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

પ્રવેશપત્ર "ON LINE" ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં (૧) "<https:// ojas.gujarat.gov.in>" વેબસાઇટ પર જવું. (૨) MCQ-OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેના ઉમેદવારોએ " Print " પર "Click" કરવું. (૩) ત્યાર બાદ "Primary Call Letter" પર "Click" કરીને Select job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં "Confirmation Number" તથા "Birth Date" ટાઇપ કરીને OK પર Click કરવાથી અલગ Window

માં આપનો **Call letter** (પ્રવેશપત્ર ) સ્ક્રીન પર દેખાશે. જે **Call Letter** તથા તે સાથેની સુચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.

ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલ-લેટર તથા સુચનાઓની વિગતો કે જે સ્પર્ધાત્મક લેખિત કસોટી સમયે હાજરીપત્રકની વિગતો ભરવા તેમજ પરીક્ષાની આગળની કાર્યવાહી માટે ખૂબ જ ઉપયોગી હોઈ તે અચૂક વાંચી જવી. ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના નાયબ સચિવશ્રી (તાંત્રિક પરીક્ષા) નો કચેરી સમય દરમિયાન ફોન નંબર:- ૦૭૯- ૨૩૨૫૩૬૨૮ પર સંપર્ક કરી શકાશે.

સ્થળ:- ગાંધીનગર  
તારીખ- ૩૦/૦૮/૨૦૧૭

સચિવ  
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ  
ગાંધીનગર